



Eim/Sec/SE

Date: 4th July, 2019

To, BSE Ltd. Phiroze Jeejeebhoy Towers 25th Floor, Dalal Street Mumbai – 400 001 Company Code 523708	To, National Stock Exchange of India Limited Exchange Plaza, C-1, Block – G, Bandra - Kurla Complex, Bandra (E), Mumbai - 400 051 Symbol EIMCOELECO - Series EQ
--	---

Subject: Publication of Notice for the 45th Annual General Meeting, Remote E-voting and Book Closure in newspaper – reg.

Dear Sir(s),

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclosed herewith copies of Notice published in Business Standard (English language) and Jai Hind (Gujarati language) on 4th July, 2019 regarding the 45th Annual General Meeting, Remote E-voting and Book Closure of the Company.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,

For Eimco Elecon (India) Limited,**Rikenkumar Dalwadi****Company Secretary & Compliance Officer**

Enclosure: As above



Renewable power projects to get 'national importance' tag

Govt hints at increasing share of Power Grid

SHREYA JAI
New Delhi, 3 July

Power transmission with renewable energy projects could soon get 'national importance' tag. This will reduce the levels of approval and the cost of a project would be shared by all beneficiary states. The private sector, however, is apprehensive that instead of competitive bidding, state-owned Power Grid Corporation of India (PGCIL) will be allotted the projects.

The National Tariff Policy mandates that all projects should be awarded through competitive bidding unless they are "specific category of projects of strategic importance", which are allotted to state-owned PGCIL, which owns 95 per cent of the transmission market.

In a meeting held two weeks back on the issues relating to renewable energy, it was decided that all transmission projects connecting renewables to the National Grid will be taken up as projects of national



importance. "All necessary regulatory steps, including issuing of directions or amendments of tariff policy required, shall be taken up accordingly and expeditiously," said the decision note, which has been reviewed by Business Standard.

The same meeting identified 66.5 Gw of transmission projects that are to be built in two phases. In the first phase comprising 29 Gw, 12.4 Gw would be awarded through competitive bidding, 3 Gw has been given to

STEP BY STEP

- 66.5 Gw of projects identified
- 12.5 Gw to go under bidding in phase 1, 3 Gw to Power Grid
- Balance capacity yet to get regulatory approval
- Transmission for RE could be tagged as "projects of national importance"
- Private sector apprehensive of losing projects to Power Grid, delays in award of projects

Power Grid and the balance is yet to get any regulatory approval. The meeting was chaired by R K Singh, minister of state for power and new & renewable energy.

Similarly, in a recent "brainstorming session" held by the ministry of power with industry and states, renewable industry complained that transmission projects are delayed and this was hampering their construction and power supply plans. In a reply to these concerns, Singh is

learnt to have reiterated power transmission would be a sector of "national interest".

Private transmission industry is, however, blaming the government for not awarding the projects.

"The 12.4 Gw, which is to be awarded through bidding, are yet to get the approval of Central Electricity Regulatory Commission (CERC). Another 5.41 Gw is yet to be tabled to the Empowered Committee on Transmission for approval. The government is delaying the project award, but is putting the blame on the industry," said an executive.

After a hiatus of over 400 days, the committee that approves transmission projects was convened in January this year. It approved 20 projects with an estimated cost of ₹16,000 crore for bidding this year. Most of these would provide connection to renewable zones, generating solar and wind energy.

In an estimate by PGCIL, power transmission sector would set a massive investment worth ₹2.6 trillion by 2022 with close to 106,000 kms of transmission lines and 292,000 MVA of transformational capacity (capacity of substations).

Don't turn IS into Bengal Vidhan Sabha: Speaker on 'cut money' issue

Speaker Om Birla on Tuesday told the sparring BJP and TMC MPs to not turn Lok Sabha into West Bengal Assembly after the members were engaged in a verbal duel on the issue of "cut money". Just after the Question Hour, Sudip Bandyopadhyay, leader of the Trinamool Congress in the House, demanded that the name of West Bengal Chief Minister Mamata Banerjee be expunged from the proceedings. He was referring to the allegations levelled by BJP MP Locket Chatterjee on Monday that local TMC leaders were charging "cut money or commission" from people in the state. **PTI**

NOTICE



HOUSING DEVELOPMENT FINANCE CORPORATION LIMITED
(CIN: L71001IN1977PLC019916)
Registered Office: Ramon House, H. T. Park, Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Tel. No: 022 6176 6000 Fax No: 022 2414 7301 Website: www.hdfc.com Email: investor@hdfc.com

NOTICE is hereby given that a Meeting of the Board of Directors of Housing Development Finance Corporation Limited ('the Corporation') is scheduled to be held on Friday, August 2, 2019 at its Corporate Office, to inter alia consider and approve the un-audited financial results (standalone) of the Corporation and the un-audited consolidated financial results, for the quarter ended June 30, 2019, subject to limited review by the Statutory Auditors of the Corporation.

The intimation submitted by the Corporation with the stock exchanges in the above connection and this Notice, is available on the website of the Corporation (www.hdfc.com), BSE Limited (www.bseindia.com) and the National Stock Exchange of India Limited (www.nseindia.com).

For Housing Development Finance Corporation Limited
Sd/-
Ajay Agarwal
Company Secretary
FCS: 9023
Place: Mumbai
Date: July 3, 2019

Bond, currency markets differ on interest rates

ANUP ROY
Mumbai, 3 July

There is a divergence between what the currency market thinks about interest rates and what the bond market perceives where rates are headed.


While the bond market is relatively conservative about their interest rate expectations, the currency market seems to be projecting that interest rates should be much sharper. However, this could be an anomaly caused by local factors, which

should correct in the coming months, experts say.

The currency market gauge rates in the form of one-year forwards premium. The forward premium is the interest rate differential between India and the US, from where dollar flows in. Hedgers pay the premium to book their future dollar receivables.

For bond market, the same interest rate differential is gauged by the difference between domestic overnight indexed swaps (OIS) and the US OIS.

FIGURES IN NUMBERS



The OIS is essentially daily average interbank call rates extrapolated to a year. Normally, the one-year forwards and the OIS difference should converge and the difference should not be more than 10-15 basis points, or even 20-25 basis points in time of extreme uncertainties. But now, the difference is about 85 basis points.

According to Samir Lodha, managing director of QuantArt, the difference has occurred because of the large exposure norms of the Reserve Bank of India (RBI).

EIMCO ELECON (INDIA) LTD.

CIN : L29199GJ1974PLC002574
Regd. Office & Works : Anand - Sojitra Road, Vallabh Vidyanagar-388120, Gujarat.
Ph : (02692) 230602 Fax : (02692) 236506.
Email: investor@eimcoelecon.in Website : www.eimcoelecon.in

NOTICE OF 45th AGM, REMOTE E-VOTING AND BOOK CLOSURE

NOTICE is hereby given that the 45th Annual General Meeting (AGM) of Members of Eimco Elecon (India) Limited ("the Company") will be held on Thursday, the 25th Day of July, 2019 at 02:30 p.m. at the Registered Office of the Company at Anand - Visual Hall, Eimco Elecon Building, Anand - Sojitra Road, Vallabh Vidyanagar - 388 120, Gujarat, to transact the Business as set out in the AGM Notice dated 7th May, 2019.

The said AGM Notice along with the Annual Report of the Company for the Financial Year 2018-19 has been sent in electronic mode to those Members whose e-mail IDs are registered with the Company or the Depository Participant (s) and physical copy of the same has been sent to those Members who have not registered their e-mail IDs with the Company or the Depository Participant(s). The AGM Notice and the Annual Report has been sent to all the Members, whose names appeared in the Register of Member/ Records of Depositories as on Friday, 21st June, 2019.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing to its Members with the facility to cast their vote electronically from a place other than venue of the AGM ("remote e-voting") using an electronic voting system provided by Central Depository Services (India) Limited ("CDSL"), on all the business items set forth in the AGM Notice and the business may be transacted through such remote e-voting.

The remote e-voting period will commence on Monday, 22nd July, 2019 (9:00 a.m. IST) and will end on Wednesday, 24th July, 2019 (5:00 p.m. IST). During this period, Members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. Thursday, 18th July, 2019, may cast their votes through remote e-voting. The remote e-voting module shall be disabled by CDSL for voting after 5:00 p.m. (IST) on Wednesday, 24th July, 2019 and remote e-voting shall not be allowed beyond the said time. The voting rights of the Members shall be in proportion to their shares in the paid-up share capital of the Company as on the cut-off date, being Thursday, 18th July, 2019 once the vote on a resolution is cast by a Member through remote e-voting, they shall not be allowed to change it subsequently. Any person, who acquires shares of the Company and becomes Member of the Company after dispatch of AGM Notice and holding shares as of the cut-off date, i.e. Thursday, 18th July, 2019, may refer to the AGM Notice of the Company, posted on Company's website www.eimcoelecon.in for detailed procedure with regard to remote e-voting. The AGM Notice is also available at www.evotingindia.com. The Company is offering facility for voting by way of polling papers at the AGM for the Members attending the meeting who have not cast their vote by remote e-voting. A Member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting, but cannot vote again at the AGM. If a Member casts vote by both modes i.e. remote e-voting and polling papers at the AGM, then voting done through remote e-voting shall prevail and polling paper shall be treated as invalid. The Members are requested to read the instructions pertaining to remote e-voting as printed in the AGM Notice carefully. In case, Members have any queries/ grievances regarding remote e-voting, they may refer to Name: Shri Rakesh Dadi, Designation: Manager, Address: A Wing, 25th Floor, Marathon Futrex, Mafatal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013. Email id: helpdesk.evoting@cslindia.com, Phone No.: 1800225533

Shri Dineshkumar G. Bhimani, Practicing Company Secretary (FCS: 8064) has been appointed as the Scrutinizer for conducting the remote e-voting and the voting process at the AGM in a fair and transparent manner.

Pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer books of the Company will remain closed from Friday, 19th July, 2019 to Thursday, 25th July, 2019 (both days inclusive) for the purpose of the declaration of dividend and AGM. The dividend as recommended by the Board of Directors, if declared at the AGM, will be paid on or after Monday, 29th July, 2019. The Annual Report, AGM Notice, Attendance Slip and Proxy Form can be downloaded from the Company's website at www.eimcoelecon.in.

This intimation may be accessed at Investor Relation section of the Company's website at www.eimcoelecon.in and may also be accessed on the Stock Exchanges website at www.bseindia.com & www.nseindia.com.

For EIMCO ELECON (INDIA) LTD.,
Place : Vallabh Vidyanagar
Date : 3rd July 2019
Rikenkumar Dalwadi - Company Secretary

આન્ધ્રા બેંક Andhra Bank

Department of Information Technology, Andhra Bank, D Block, II Floor, Cyber Gateway, Hitec-City, Madhapur, Hyderabad - 500081.
Tel.No:040-23122336/23122266 (Fax:040-23122261)
Email: cbs-nw-security@andhrabank.in

Request For Proposal for rebuild of Data Centre, NOC, System room and providing FM services and AMC of BMS equipment.
• RFP Fee: ₹ 25,000/- payable along with Bid Response (nonrefundable).
• EMD For ₹ 25,00,000/- to be submitted along with Technical Bid.
For details/last date of receipt of proposals etc contact either the above address or visit Andhra Bank Web Site at www.andhrabank.in. General Manager (DIT)

TENDER NOTICE

Sealed tenders are invited for disposal of the fire damaged various types of electrical & electronic items like Routers, Disk Antenna, Cables, Media Converters & Air Conditioner etc. on 'As is where is basis' of M/s. GTPL Broadband Pvt. Ltd. and M/s. GTPL Hathway Ltd., lying at 12/A & 12/B, Devraj Industrial Park, Pipalaj - Pirana Road, Village: Pipalaj, Ahmedabad, Gujarat. Inspection of materials may be conducted between 11.00 am to 4:00 pm on all the working days of the week. For inspection of the goods, Contact Mr. Kapil Kulshrestha (Mo: 9039098880) & / or Mr. Mukesh Sonara (Mo: 9712956094) at the godown at the above address. Tenders to be submitted on the letterheads of the Tenderers along with an Earnest Money of 10% of the total offer amount by Demand Draft in favour of "GTPL HATHWAY LIMITED" payable at Ahmedabad in sealed envelope within 10 days of publication of this tender notice to M/s. GTPL Broadband Pvt. Ltd. F.P. No. 50, Opposite: Armeida, Sindhu Bhavan Road, Bodakdev, Ahmedabad - 380059. Offer to the office of the surveyors M/s. Kothari Insurance Surveyors & Loss Assessors Investigators Pvt. Ltd., OM Tower, Suite No. 505, 32, Jawaharalal Nehru Road, Kolkata - 700 071. Sealed envelope should be superscribed with the "QUOTATION OF FIRE DAMAGE ELECTRICAL & ELECTRONIC ITEMS OF M/S. GTPL BROADBAND PVT. LTD. AND GTPL HATHWAY LTD." and it must have the Name, Address and contact phone nos. of the Tenderers.

NOTE: (i) The total amount of offer should be above Rs. 5 Lakhs (Five Lakhs) on lump-sum basis otherwise the same would not be considered. (ii) A ny tender submitted without EMD shall be invalid and summarily rejected. (iii) The tenders shall be opened in presence of Insured, Surveyor and Nominated Officer of Insurance Company within 7 days of closing of tender submission. Successful bidder will be informed latest within 3 days of tender opening and the highest bidder shall be treated as the successful tenderer. (iv) All taxes applicable at site will be payable by the buyer/ successful bidder at the time of issuing of Delivery Order. The Seller/ Insured/ Insurance Company/ Surveyors reserves the right to accept or reject any offer without assigning any reason.

RBL BANK

apno ka bank
RBL BANK LIMITED
CIN: L65191PN1943PLC007308
Regd. Office: 1st Lane, Shahupuri, Kolhapur - 416001
Tel: + 91 2316650214, Fax: + 91 0231 2657386,
Website: www.rblbank.com Email: investorgrievances@rblbank.com

NOTICE

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of RBL Bank Limited ("the Bank") will be held on Friday, 19th July, 2019 at the Corporate Office of the Bank at One Indiabulls Centre, Tower 2B, 6th Floor, 841, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai - 400013, inter alia, to consider and approve the un-audited financial results of the Bank for the quarter ended June 30, 2019.

This information is also available on the website of the Bank i.e. www.rblbank.com and on the website of stock exchanges at www.nseindia.com & www.bseindia.com.

For RBL Bank Limited
Rajeev Ahuja
Executive Director
Place : Mumbai
Date : July 3, 2019

Gujarat Informatics Limited

Block No. 2, 2nd Floor, C & D Wing, Karmayogi Bhavan, Sector-10A, Gandhinagar, Phone:079-23256022, Fax:079-23238925 Website : <http://gil.gujarat.gov.in>

NOTICE INVITING BIDS

GIL invites bids through E-tendering route for

- 1) Selection of Agency for providing Comprehensive Annual Maintenance Contract of Servers, Storage and related peripherals of HRMS Project on behalf of General Administration Department, Government of Gujarat. (Tender No. HWT020719561)
- 2) Establishment of Digital Education & Learning Labs (DELL) in Colleges of State of Gujarat including Supply of Hardware, Software & Manpower including Maintenance of the Systems for 5 years on behalf of Society for Creation of Opportunity Through Proficiency in English (SCOPE), Commissioner of Higher Education, Education Department, Government of Gujarat. (Tender No. HWT020719562)
- 3) Selection of Agency for providing Comprehensive Annual Maintenance Contract of Central Storage System for NLE & Digital Asset Management Video Library on behalf of Directorate of Information, Gandhinagar. (Tender No. HWT030719563)
- 4) Selection of Service Provider for Providing WI-FI services on Service Model including (Design, Built, and Operations & Management) at Gujarat Institute of Disaster Management (GIDM), Gandhinagar. (Tender No. HWT03072019564)

Interested parties may visit <http://www.gil.gujarat.gov.in> or <https://www.gil.procure.com> for eligibility criteria & more details about the bids.
- Managing Director

બેંક ઓફ બરોડા Bank of Baroda

Zonal Stressed Assets Recovery Branch : Ahmedabad Zone, 4th floor, Bank of Baroda Towers, Nr. Law Garden, Ellisbridge, AHMEDABAD-380006. Phone : 079 26473131. Email : armahm@bankofbaroda.co.in

SALE NOTICE FOR SALE OF MOVABLE AND IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Movable & Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6(2) & (8) of the security interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and Guarantor(s) that the below described movable & immovable properties hypothecated/pledged/charged/mortgaged to the Bank of Baroda, the physical possession of which has been taken by the Authorized Officer of Bank of Baroda Secured Officer, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 24th July, 2019 for recovery of below mentioned accounts. The details of the Borrowers / Guarantors/ Assets / Dues / Reserve Price / EMD & e auction date described as under:

Name of Borrower/s & Guarantor/s and Dues as per Demand Notice	Description of Properties	Reserve Price & EMD, Bid Increase Price
[1] M/s Hanuman Cotton Industries a partnership firm having its office at Survey No. 43/P/7, Khambha Road, Nar Girchar Vav, Village-Savarnamad, Savarkunda-365421, Dist. Amreli & its Partners & Guarantors: 1. Mr. Bavchandrabhai Ramjiabhai Vekariya 2. Mr. Bhupathabhai Ramjiabhai Vekariya 3. Mr. Vinubhai Ramjiabhai Vekariya 4. Mr. Kaniyalal Bavchandrabhai Vekariya 5. Mr. Chiragbhai Bhupathabhai Vekariya 6. Mr. Mukhsbhai Bavchandrabhai Vekariya 7. Mr. Jigneshbhai Vinubhai Vekariya 8. Mrs. Ramlatben Vinubhai Vekariya 9. Mrs. Nandubhen Ramjiabhai Vekariya Legal heir of Late Mr. Ramjiabhai Dudabhai Vekariya 10. Mrs. Muktaben Ramjiabhai Vekariya Legal heir of Late Mr. Ramjiabhai Dudabhai Vekariya 11. Mrs. Champabhen Ramjiabhai Vekariya Legal heir of Late Mr. Ramjiabhai Dudabhai Vekariya 12. Mrs. Shardaben Ramjiabhai Vekariya Legal heir of Late Mr. Ramjiabhai Dudabhai Vekariya 13. Mrs. Ushaben Ramjiabhai Vekariya Legal heir of Late Mr. Ramjiabhai Dudabhai Vekariya 14. Mrs. Jigneshbhai Vinubhai Vekariya 15. Mrs. Nandubhai Vekariya 16. Mrs. Nandubhai Vekariya 17.01.2017 Total dues Rs. 8,33,29,311.31 (Rupees Eight Crore Thirty Three Lacs Twenty Nine Thousand Three Hundred Eleven and Thirty One Paise Only) as on 01.01.2017 plus further interest there on at the contractual rate plus cost charges and expenses till date of payment less recovery)	(1) Factory Land Building i.e. All that piece and parcel of immovable industrial property, consisting of Plot No. 1, total measuring H-1-64-91 with construction thereon bearing N.A Revenue Survey No. 43 P 7 Village: Savarnamad, Khambha Road, Near Gircharavav, Savarkunda, Dist. Amreli owned by M/s Hanuman Cotton Industries	Reserve Price Rs. 1,90,50,000/- EMD: Rs.19,05,000/- Bid Inc: Rs.50,000/-
[2] M/s R. D. Cotlink Pvt. Ltd. a company having its office situated at 43/7, SVF, Near Rajdhani Hotel, Savarkunda, Dist. Amreli & its Director: Mr. Bavchandrabhai Ramjiabhai Vekariya 2. Mr. Bhupathabhai Ramjiabhai Patel 3. Mr. Chintanbhai Vinubhai Vekariya 4. Mr. Chiragbhai Bhupathabhai Vekariya 5. Mr. Jignesh Vinubhai Vekariya 6. Mr. Mukhsbhai Bavchandrabhai Vekariya 7. Mr. Vinodrai Ramjiabhai Patel 8. Mr. Dhinubhai Marbha Jalevadia (As per Demand Notice U/s 13(2) dated 13.01.2017 Total dues Rs. 5,32,88,159.00 (Rupees Five Crores Thirty Two Lacs Eighty Eight Thousand One Hundred Fifty Nine only) as on 01.01.2017 plus further interest thereon at the contractual rate plus cost charges and expenses till date of payment less recovery)	(2) All Plant & machineries situated at Factory premises at Survey No. 43/P/7, Khambha Road, Near Gircharavav, Village: Savarnamad, Savarkunda-365421, Dist. Amreli belonging to M/s Hanuman Cotton Industries	Reserve Price Rs.26,50,000/- EMD: Rs.2,65,000/- Bid Inc:Rs. 25,000/-
[3] M/s Ketan Jute Bags Pvt. Ltd.-Guarantors: 1. Maheshbhai B Tanna 2. Pradipbhai B Tanna 3. Ketan Pradipbhai Tanna 4. Mayurbhai Maheshbhai Tanna 5. Maheshbhai M Tanna (As per Demand Notice U/s 13(2) dated 16.01.2017 Total dues Rs. 2,72,97,557.68 (Rupees Two Crore Seventy Two Lacs Ninety Seven Thousand Five Hundred Fifty Seven Rupees and Sixty Eight Paise) as on 16.01.2017 plus further interest thereon at the contractual rate plus cost charges and expenses till date of payment less recovery)	(3) Residential Plots i.e. All that piece and parcel of immovable residential property, bearing Revenue Survey No. 71-2 (open plot 4, 5, 6, 7, 8, 9) situated with land area 1032/84 Sq Mtr Mahuva Road, Opposite ITI Institute, Savarnamad, Savarkunda, Dist. Amreli owned by Mr. Ramjiabhai Dudabhai Vekariya	Reserve Price Rs.28,30,000/- EMD: Rs.2,83,000/- Bid Inc:Rs. 25,000/-
[4] M/s Ketan Jute Bags Pvt. Ltd. a company having its office situated at 43/7, SVF, Near Rajdhani Hotel, Savarkunda, Dist. Amreli & its Director: Mr. Bavchandrabhai Ramjiabhai Vekariya 2. Mr. Bhupathabhai Ramjiabhai Patel 3. Mr. Chintanbhai Vinubhai Vekariya 4. Mr. Chiragbhai Bhupathabhai Vekariya 5. Mr. Jignesh Vinubhai Vekariya 6. Mr. Mukhsbhai Bavchandrabhai Vekariya 7. Mr. Vinodrai Ramjiabhai Patel 8. Mr. Dhinubhai Marbha Jalevadia (As per Demand Notice U/s 13(2) dated 13.01.2017 Total dues Rs. 5,32,88,159.00 (Rupees Five Crores Thirty Two Lacs Eighty Eight Thousand One Hundred Fifty Nine only) as on 01.01.2017 plus further interest thereon at the contractual rate plus cost charges and expenses till date of payment less recovery)	(1) Factory Land & Building i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 01, measuring 11-1-21-41 Sq. Mtrs, N.A. R.S. No. 20/p-7 & Construction regarding the property put under the limit of Junagadh Municipal Corporation Tal. And Dist. Junagadh possessed by M/s R.D. Cotlink Pvt. Ltd.	Reserve Price Rs.14,58,400/- EMD: Rs.14,58,400/- Bid Inc: Rs.50,000/-
[5] Residential Plot i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 22, measuring 185/10 Sq. Mtrs, N.A. R.S. No. 66/p, Village Savar Samapadar, Mahuva Road, Near Honda Showroom, Tal. Savarkunda, Dist. Amreli owned by Mr. Bhupathabhai Ramjiabhai Vekariya	(2) All Plant & Machineries situated at Factory Building R.S. No. 20/p-7, Village-Ba dhada, Tal:Savarkunda, Dist. Amreli owned by M/s R.D. Cotlink Pvt. Ltd.	Reserve Price Rs.55,00,000/- EMD: Rs.5,50,000/- Bid Inc: Rs.25,000/-
[6] Residential Plot i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 24, measuring 193/80 Sq Mtrs, N.A. R.S. No. 66/p, Village Savar Samapadar, Mahuva Road, Near Honda Showroom, Tal. Savarkunda, Dist. Amreli owned by Mr. Bhavchandrabhai Ramjiabhai Vekariya	(3) Residential Plot i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 23, measuring 193/80 Sq Mtrs, N.A. R.S. No. 66/p, Village Savar Samapadar, Mahuva Road, Near Honda Showroom, Tal. Savarkunda, Dist. Amreli owned by Mr. Bhupathabhai Ramjiabhai Vekariya	Reserve Price Rs.24,72,000/- EMD: Rs.2,47,200/- Bid Inc: Rs.25,000/-
[7] Residential Plot i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 22, measuring 185/10 Sq. Mtrs, N.A. R.S. No. 66/p, Village Savar Samapadar, Mahuva Road, Near Honda Showroom, Tal. Savarkunda, Dist. Amreli owned by Mr. Vinubhai Ramjiabhai Vekariya alias Vinodrai Ramjiabhai Patel	(4) Residential Plot i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 22, measuring 185/10 Sq. Mtrs, N.A. R.S. No. 66/p, Village Savar Samapadar, Mahuva Road, Near Honda Showroom, Tal. Savarkunda, Dist. Amreli owned by Mr. Vinubhai Ramjiabhai Vekariya alias Vinodrai Ramjiabhai Patel	Reserve Price Rs.23,61,000/- EMD: Rs.2,36,100/- Bid Inc: Rs.25,000/-
[8] All that immovable property namely a factory building constructed on land measuring Sq. Mtrs 930.00 of Plot No. 701 (with land and construction) of N.A. land of S. No. 18/4 situated in G.I.D.C.-II area, located at Dolapura/ Sabapur under the limit of Junagadh Municipal Corporation Tal. And Dist. Junagadh possessed by M/s Ketan Jute Bags Pvt Ltd.	(5) Residential Plot i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 22, measuring 185/10 Sq. Mtrs, N.A. R.S. No. 66/p, Village Savar Samapadar, Mahuva Road, Near Honda Showroom, Tal. Savarkunda, Dist. Amreli owned by Mr. Vinubhai Ramjiabhai Vekariya alias Vinodrai Ramjiabhai Patel	Reserve Price Rs.1,17,94,000/- EMD: Rs.11,79,400/- Bid Inc: Rs.25,000/-
[9] All that movable property namely plant and machineries and other assets lying in the company at Plot No. 701 of N.A. land of S. No. 18/4 situated in G.I.D.C.-II area, situated at Dolapura/ Sabapur under the limit of Junagadh Municipal Corporation Tal. And Dist. Junagadh in the name of M/s Ketan Jute Bags Pvt Ltd.	(6) Residential Plot i.e. All that piece and parcel of immovable property situated at Plot No. 22, measuring 185/10 Sq. Mtrs, N.A. R.S. No. 66/p, Village Savar Samapadar, Mahuva Road, Near Honda Showroom, Tal. Savarkunda, Dist. Amreli owned by Mr. Vinubhai Ramjiabhai Vekariya alias Vinodrai Ramjiabhai Patel	Reserve Price Rs.7,06,000/- EMD: Rs.70,600/- Bid Inc: Rs.10,000/-

Name of Authorised Officer : Mr. K.C. Sharma, AGM, ZOSARB, Ahmedabad. Mob. 9978446502
Date of Inspection : 11.07.2019

Last date for EMD and submission of online Bid : 23.07.2019 Up to 4:00 PM

Date and Time of E-Auction : 24th JULY, 2019 from 12:00 Noon to 1:00 PM

Bank Name : Bank of Baroda, Navrangpura, Ahmedabad A/C No: 0333020001526, Current A/C.

A/c name: BOB Asset Recovery Management IFSC Code: BARBONAVRAN

TERMS & CONDITIONS OF THE AUCTION : (1) The auction sale will be 'Online e-auction / Bidding through website <https://bob.auctiontiger.net> (Property also available On Auction Tiger Mobile App) on date and time mentioned above with unlimited extensions of 5 minutes duration each (2) The interested bidders who require assistance in creating Login ID & Password, uploading data, submitting bid, training on e-bidding process etc., may contact E-auction Tiger, Ahmedabad, Gujarat, India, Phone No: 9978591888, Email Id-chintan.bhatt@auctiontiger.net, Email Id : gujarat@auctiontiger.net, Support Contact Detail 9265562821, 079-61200594/598/568/587/538 AUCTION TIGER TOLL FREE NUMBER : 18001035342 (3) Bidders are advised to go through the website <https://bob.auctiontiger.net> (Property also available On Auction Tiger Mobile App) for detailed terms and conditions of auction sale before submitting their bids and taking part in the e-auction sale proceedings. (4) Bids shall be submitted through online procedure only in the prescribed format with relevant details. (5) Earnest Money Deposit (EMD) shall be deposited through RTGS/NEFT/ Fund Transfer to credit of Sundry Dept. of the Branch through RTGS in account with IFSC code mentioned above. (6) A copy of the bid form along with the enclosures submitted online (also mentioning the UTR No.) shall be forwarded to the Authorized Officer, Bank of Baroda, on branch address mentioned above so as to reach on or before 23rd July, 2019. (7) The successful bidder shall have to pay 25% of the purchase amount immediately (including Earnest Money already paid) from knocking down of bid in his/her favour, in the same mode as stipulated in clause 5 above. The balance 75% of the purchase price shall have to be paid within 15 days of acceptance / confirmation of sale conveyed to them. In case of default, all amounts deposited till then shall be forfeited including earnest money. (8) The EMD

